

B.Com. Semester - 5 (Remedial) (CBCS) Examination
March/April-2025 (NEW COURSE)
Indirect Tax Law - 1(Dse-3)

Time: 2:30 Hours

Marks: 70

Instructions:

1. All questions are compulsory.
2. Figures to the right indicate marks.

પ્રશ્ન. ૧ પ્રત્યક્ષ અને પરોક્ષ કરવેરાનો તફાવત સમજાવી તે અંતર્ગત GST નો અર્થ અને તેની ભારતમાં જરૂરિયાત અંગે વિસ્તૃત સમજ આપો. (૨૦)

અથવા

પ્રશ્ન. ૧ GST અંગે નીચેના ખ્યાલોની યોગ્ય ઉદાહરણ સાથે સમજૂતી આપો;

- 1) CGST 2) SGST 3) UTGST 4) IGST

પ્રશ્ન. ૨ GST હેઠળ અવેજ સાથેનો અને અવેજ વગરનો પૂરવઠાનો ખ્યાલ વિસ્તાર પૂર્વક સમજાવો. (૨૦)

અથવા

પ્રશ્ન. ૨ GST હેઠળ સંયુક્ત (Composite) અને મિશ્ર (Mixed) પૂરવઠો યોગ્ય ઉદાહરણ સાથે સમજાવો.

પ્રશ્ન. ૩ માલના પૂરવઠાનો સમય નક્કી કરવા અંગે ફોરવર્ડ ચાર્જ અને રિવર્સ ચાર્જની સમજૂતી આપો. (૧૫)

અથવા

પ્રશ્ન. ૩ સેવાના પૂરવઠાનો સમય નક્કી કરવા અંગે ફોરવર્ડ ચાર્જ અને રિવર્સ ચાર્જની સમજૂતી આપો.

પ્રશ્ન. ૪ નીચેનામાંથી કોઈ પણ ૩ જીએસટીને સંબંધિત શબ્દોની સમજ આપો. (૧૫)

- (1) એજન્ટ (2) અવેજ (3) વ્યક્તિ
 (4). વ્યવહારનું મૂલ્ય (5) વ્યવહારમાં વટાવની બાદબાકી

ENGLISH VERSION

Que.1 Explain the difference between direct and indirect taxes and give a detailed understanding of the meaning of GST and its need in India. (20)

OR

Que.1 Explain the following concepts about GST with an appropriate example;

- 1) CGST 2) SGST 3) OUTPUT 4) IGST

Que.2 Describe the concept supply with consideration and supply without consideration under GST. (20)

OR

Que.2 Explain composite and mixed supplies under GST with the suitable examples.

Que.3 Explain the Forward and Reverse charge in determining the time of supply of goods. (15)

OR

Que.3 Explain the Forward and Reverse charge in determining the time of supply of service.

Que.4 Explain any 3 terms related to GST. (15)

- (1) Agent (2) Avage (3) Person
 (4) Value of transaction (5) Exclusion of overtones in practice
